

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ જુલાઈ 2 થી અમલમાં મૂકીને, વધારેલી ક્ષમતા સાથે બસો ચલાવશે

નોન-મેડિકલ મારક્સ અનિવાર્ય રહેશે, બસમાં ભાડું ચૂકવણી અને આગળના દરવાજાથી પ્રવેશ ફરીથી શરૂ કરવામાં આવશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 29, 2020) – પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે અને સીટી ઓફ બ્રેમ્પટનના રિઓપનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, ગુરુવાર, જુલાઈ 2 થી શરૂ કરીને, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વધારેલી બસ ક્ષમતા સાથે કાર્યરત થશે.

સીટી ઉતારુઓને યાદ અપાવે છે કે પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં મારક્સ પહેરવાની કડક ભલામણને અનુસરીને, બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ અને ઓપરેટરો માટે બસોમાં અને ટર્મિનલ્સ પર જુલાઈ 2 થી નોન-મેડિકલ મારક્સ પહેરવા અનિવાર્ય બનશે. બસમાં ભાડું ચૂકવણી અને આગળના દરવાજાથી પ્રવેશ પણ ફરીથી શરૂ થશે.

બસોમાં વધારેલી ક્ષમતા

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ જુલાઈ 2 થી શરૂ કરીને પોતાની બસો વધારેલી ક્ષમતા સાથે ચલાવશે અને એ જ દિવસથી શરૂ કરીને ઉતારુઓએ નોન-મેડિકલ મારક્સ પહેરવા અનિવાર્ય બનશે. દરેક બસ પર આપેલી છૂટ પ્રમાણે ઉતારુઓની મહત્તમ સંખ્યા નીચે જણાવ્યા પ્રમાણે રહેશે:

- 40 ફૂટની બસ: 35 લોકો
- 60 ફૂટની બસ: 55 લોકો

આ વધારેલી ક્ષમતા બેઠકોની ક્ષમતા પૂરેપૂરી ભરાઈ જવા બરાબર જેટલી છે. ઉતારુઓ બસમાં બેસી કે ઊભા રહી શકે છે. એ મહત્વનું છે કે પબ્લિક ટ્રાન્ઝિટમાં સવારી કરતી વખતે ઉતારુઓ બધાં સમયે મારક્સ પહેરી રાખે કારણ કે આનાથી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આ વધારેલી ક્ષમતા સાથે સંચાલન કરી શકશે. માર્ક પહેરવાનું પાલન ન કરવાનું પરિણામ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ અગાઉની જેમ બસો ઓછી ક્ષમતામાં ચલાવવા મજબૂર બને તેવું આવી શકે છે. બસોનું સંચાલન જુલાઈ 2 સુધી અડધી બેઠક ક્ષમતા સાથે ચાલુ રહેશે.

નાના બાળકો અને જોખમી વસ્તી માટે અપવાદો

મારક્સ પહેરવા અનિવાર્ય છે ત્યારે, તેમાં કેટલાક અપવાદો છે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો, અથવા તબીબી કારણોસર માર્ક પહેરવામાં અસમર્થ લોકોને તેમાંથી છૂટ આપવામાં આવશે પરંતુ તેઓને અન્ય લોકોથી બે મીટરનું શારીરિક અંતર જાળવવાનું કહેવામાં આવે છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સમુદાયને આરોગ્યપ્રદ અને સુરક્ષિત રાખવા પર ધ્યાન આપે છે. ટ્રાન્ઝિટ ઉતારુઓને પોતાની સારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા, સુરક્ષા ઉપાયોને વળગી રહેવા, અને માર્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે જો તેઓ સક્ષમ હોય.

માત્ર મારક્સ પહેરવાથી COVID-19 નો ફેલાવો ટાળી શકાશે નહિ પરંતુ તે તમારી આસપાસની વ્યક્તિઓને સંરક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે. મારક્સ પહેરતી વખતે, હાથ સતતપણે સારા એવા સ્વચ્છ રાખવાનો મહાવરો કરવો અને શક્ય હોય ત્યારે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર

જાળવવાનું મહત્વ હજુ પણ રહે છે. જો તમે બીમાર હો તો, ટ્રાન્ઝિટનો ઉપયોગ ટાળીને, COVID-19 એસેસમેન્ટ સેન્ટરમાં કે મોબાઈલ સાર્થટ પર પરીક્ષણ કરાવો અને ઘરે રહો.

તમારા નોન-મેડિકલ માર્સ્ક યોગ્ય રીતે પહેરવા, બેસાડવા, કાઢી નાખવા અને સાફ રાખવાની રીત સહિત, નોન-મેડિકલ માર્સ્કના સંદર્ભમાં વધુ માહિતી માટે, પીલ પબ્લિક હેલ્થની [વેબસાઈટ](#) અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની [વેબસાઈટ](#) જુઓ.

ભાડું ચૂકવણી

જુલાઈ 2 થી શરૂ કરીને બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બધી બસોમાં ભાડું ચૂકવવું જરૂરી બનશે. ઉતારુઓને પોતાનું ભાડું સંપર્કરહિત ચૂકવણી સ્વરૂપે કરવા પોતાના PRESTO કાર્ડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. પોતાની મુસાફરી માટે ચૂકવણી કરવા હજુ પણ રોકડ રકમનો ઉપયોગ કરતા ઉતારુઓને, કસ્ટમર સર્વિસ કાઉન્ટર પરથી PRESTO કાર્ડ મેળવી લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. માત્ર સીમિત સમય માટે, \$6 ની PRESTO કાર્ડ ફી માફ કરવામાં આવી છે – ગ્રાહક દીઠ એક કાર્ડ.

આ શહેરમાં વયોવૃદ્ધ વડીલો માટે પહોંચ સુલભ ટ્રાન્ઝિટ પૂરું પાડવું ટોચની અગ્રતા છે, અને COVID-19 નાં પ્રભાવને ધ્યાનમાં લેતા, બધાં સક્રિય સીનિયર આઈડી કાર્ડની સમાપ્તિની તારીખ અચોક્કસ સમય સુધી માફ કરવામાં આવી છે.

ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ પર કસ્ટમર કાઉન્ટર્સ, ટ્રિનિટી કોમન ટર્મિનલ બિલ્ડિંગના અપવાદ સાથે, ખુલ્લા છે.

વર્ષ 2020 માટે ભાડામાં દરખાસ્ત હેઠળના ફેરફારો આગળ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે.

બસમાં આગળના દરવાજાથી પ્રવેશ

બ્રમ્પટન ટ્રાન્ઝિટ જુલાઈ 2 થી શરૂ કરીને બધાં ઉતારુઓને બસમાં આગળના દરવાજાથી પ્રવેશવાની છૂટ આપશે. ઉતારુઓએ પાછળના દરવાજાથી બહાર નીકળવાનું રહેશે.

એક્સેસિબિલિટી (પ્રવેશ સુલભતા) જરૂરિયાતો ધરાવતા ઉતારુઓ આગળના દરવાજાથી બસમાંથી બહાર નીકળવાનું ચાલુ રાખી શકે છે.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજિંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માસ્ક પહેર્યો હોય તો પણ, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવા વિનંતી કરે છે. ઉતારુઓને મુસાફરી કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે ઈંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, સીટી ઓફ બ્રમ્પટન દરેક વ્યક્તિને નોન-મેડિકલ માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું પડકારભર્યું હોઈ શકે. સીટી ઓફ બ્રમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

અવતરણો (ક્વોટ્સ):

“અમારા રિઓર્ગનાઈઝેશન અને રિક્વરી પ્લાનના ભાગરૂપે, જુલાઈ 2 થી શરૂ કરીને બ્રમ્પટન ટ્રાન્ઝિટમાં ઘણાં ફેરફારો થવાના છે. બસો વધારેલી ક્ષમતા સાથે ચાલશે, નોન-મેડિકલ માસ્ક્સ કે ફેસ કવરિંગ્સ અનિવાર્ય બનશે, અને બસમાં ભારું ચૂકવણી અને આગળના દરવાજાથી પ્રવેશ ફરીથી ચાલુ કરવામાં આવશે. આ ફેરફારો સમુદાયને આરોગ્યપ્રદ અને સુરક્ષિત રાખવાની સાથે સાથે બ્રમ્પટનમાં આપણી પાસે કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર ટ્રાન્ઝિટ સર્વિસ હોવાની ખાતરી કરાવશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“મને વિશ્વાસ છે કે અમે બ્રમ્પટન ટ્રાન્ઝિટમાં બેઠક ક્ષમતા વધારી રહ્યાં છીએ ત્યારે, ઉતારુઓ જો સક્ષમ હોય તો નોન-મેડિકલ માસ્ક્સ પહેરીને પોતાના માટે, ટ્રાન્ઝિટ ઓપરેટરો અને એકબીજા માટે આદરપૂર્વક વર્તશે, અને સારા સ્વચ્છતાશાસ્ત્રનો મહાવરો કરશે. અમે ઉતારુઓને અવરજવર કરવા સક્ષમ બનાવી રહ્યાં છીએ, અને સાથે મળીને, આપણે COVID-19 સંક્રમણનું જોખમ ઘટાડી શકીએ છીએ.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“રિઓપનિંગ અને રિકવરી વર્કિંગ ગ્રૂપ મારફતે, આપણાં શહેરને ફરીથી ખોલવામાં એક વ્યાપક અને એકસરખો અભિગમ અપનાવવાની ખાતરી કરાવવા અમે સમુદાય સાથે અર્થસભર ચર્ચાઓ કરવાનું ચાલુ રાખ્યું છે. આ નિર્ણય પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે અને ઉતારુઓને અગ્રતા સ્થાને રાખવાની જરૂરિયાત પ્રમાણે લેવામાં આવ્યો છે.”

- *માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આપણાં સમુદાયને આરોગ્યપ્રદ અને સુરક્ષિત રાખવા સખત મહેનત કરી રહ્યું છે. અમે વધારેલી ક્ષમતા સાથે સંચાલન કરી શકીએ છીએ કારણ કે એ જ દિવસથી શરૂ કરીને નોન-મેડિકલ માર્ક્સ પહેરવા અનિવાર્ય બનશે. ઉતારુઓ – કૃપા કરી આપણી ટ્રાન્ઝિટ સર્વિસને આરોગ્યપ્રદ, સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર રાખવામાં તમારો ભાગ ભજવશો.”

- *ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca